

ત્વરિત જાહેરાત માટે

બ્રેમ્પટનને વધારે જોડવા, ટકાઉ બનાવવા સાથે મળીને કાર્યરત છીએ

ફેડરલ ગવર્નમેન્ટ પાસેથી \$45.3 મિલિયન ઉપરાંતનું અને પ્રોવિન્સિયલ ગવર્નમેન્ટ પાસેથી \$37.8 મિલિયન ઉપરાંતનું રોકાણ સીટી પબ્લિક ટ્રાન્ઝિટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેના ભંડોળમાં મેળવશે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (જુલાઈ 28, 2020) – આજે, મેયર પેટ્રિક બ્રાઉન (Patrick Brown) અને સીટી કાઉન્સિલે ગવર્નમેન્ટ ઓફ કેનેડા અને ગવર્નમેન્ટ ઓફ ઓન્ટેરિયો પાસેથી નોંધપાત્ર રોકાણને આવકાર્યું જે બ્રેમ્પટનમાં પબ્લિક ટ્રાન્ઝિટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સીધી સહાયતા પૂરી પાડશે.

મિનિસ્ટર ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ કમ્યુનિટીસ, માનનીય કેથરીન મેકેન્ના (Catherine McKenna) દ્વારા પબ્લિક ટ્રાન્ઝિટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટ્રીમ (PTIS) મારફતે ચાર પ્રોજેક્ટ્સમાં \$45.3 મિલિયન ઉપરાંતના ગવર્નમેન્ટ ઓફ કેનેડાના રોકાણની ઘોષણા કરવામાં આવી.

મિનિસ્ટર મેકેન્નાની ઘોષણા પછી, ઓન્ટેરિયોના મિનિસ્ટર ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માનનીય લૉરી સ્કોટ (Laurie Scott) વતી, એસોસિએટ મિનિસ્ટર ઓફ સ્મોલ બિઝનેસ એન્ડ રેડ ટેપ રિડક્શન, માનનીય પ્રબમીત સિંહ સરકારીયા (Prabmeet Singh Sarkaria), અને બ્રેમ્પટન સાઉથ માટે પ્રોવિન્સિયલ પાર્લામેન્ટના સભ્યએ ઘોષણા કરી કે ગવર્નમેન્ટ ઓફ ઓન્ટેરિયો પબ્લિક ટ્રાન્ઝિટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં \$37.8 મિલિયન ઉપરાંતનો ફાળો આપવાનું છે.

સીટી ઓફ બ્રેમ્પટન \$30.2 મિલિયન ઉપરાંતનો ફાળો; બંધો સંયુક્ત રીતે કેનેડા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનમાં રોકાણ મારફતે આપી રહ્યું છે.

ચાર પ્રોજેક્ટ્સમાં સામેલ છે:

- **2020-2021 શિલ્ડેસમેન્ટ બસીસ (બસોની ફેરબદલી):** વર્તમાન સેવા સ્તરો જાળવવા અને જૂની બસોનો (નિવૃત્ત થતો) કાફલો બદલવા 32 પરંપરાગત બસો ખરીદવી.
 - ફેડરલ ભંડોળ: \$9,132,000
 - પ્રોવિન્સિયલ ભંડોળ: \$7,609,239
 - મ્યુનિસિપલ ભંડોળ: \$6,088,761
- **2020-2024 બસોનું નવીનીકરણ:** એન્જિન, સરપેન્શન્સ અને બ્રેકસ જેવા મોટા પુરજાઓનું સમારકામ અને તબદીલી સહિત, 300 પરંપરાગત બસોનું નવીનીકરણ.
 - ફેડરલ ભંડોળ: \$22,243,218
 - પ્રોવિન્સિયલ ભંડોળ: \$18,534,161
 - મ્યુનિસિપલ ભંડોળ: \$14,830,666
- **બસોમાં (ઓન-બોર્ડ) કેમેરા અને ડિજિટલ વિડીયો રેકોર્ડર્સની ફેરબદલ:** સમગ્ર બસ કાફલામાં વધારે નવી ટેકનોલોજી ઉમેરવી.
 - ફેડરલ ભંડોળ: \$2,000,000
 - પ્રોવિન્સિયલ ભંડોળ: \$1,666,500
 - મ્યુનિસિપલ ભંડોળ: \$1,333,500
- **ડાઉનટાઉન ટ્રાન્ઝિટ મોબિલિટી હબ:** એક નવું ટ્રાન્ઝિટ હબ જેનાથી બસ બે (બસ લે-બાય) સંખ્યા વધારવામાં આવશે, જેનાથી વધારે સર્વિસ, નવી બસ કેનોપીસ (છત), પ્રતીક્ષાલય (વેઈટિંગ એરિયા), છૂટછાટો (કન્સેશન્સ) પૂરી પાડી શકાશે અને ઇલેક્ટ્રિક બસો રાખવા હબ આધુનિક કરવાની જરૂરિયાતોનો સમાવેશ કરી શકાશે.

- ફેડરલ ભંડોળ: \$12,000,000
- પ્રોવિન્સિયલ ભંડોળ: \$9,999,000
- મ્યુનિસિપલ ભંડોળ: \$8,001,000

અવતરણો (ક્વોટ્સ):

“આજે ઘોષણા કરેલા રોકાણોથી બધાં લોકો માટે વધારે સુરક્ષિત અને વધારે આરોગ્યપ્રદ પરિવહન ઉકેલ પૂરો પાડીને, આપણી ઝડપથી વિકસી રહેલી ટ્રાન્ઝિટ સિસ્ટમની ક્ષમતા અને ગુણવત્તા વધારવામાં મદદ મળશે. આપણાં ફેડરલ અને પ્રોવિન્સિયલ ભાગીદારોની મદદ વડે, અમે અમારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સહાયતા કરીને અને વિકસાવીને આપણાં સમુદાયોમાં રોકાણ કરી શકીએ છીએ. વિશ્વાસપાત્ર ટ્રાન્ઝિટ સેવાઓ અને નોકરીઓ સુધી પહોંચી ક્ષમતા વધારવામાં, ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવામાં અને આપણાં સમુદાયનું એકંદરે આરોગ્ય સુધારવામાં મદદરૂપ થાય છે. હું બ્રમ્પટનમાં અહીં આપણાં સમુદાયને સહાયરૂપ થવા સતત સાથે મળીને કાર્યરત રહેવા આશાવાદી છું.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રમ્પટન

“આજની ઘોષણા આપણાં શહેર માટે મહત્વનું સીમાચિહ્નરૂપ ચિહ્નિત કરે છે. આ ચાર પ્રોજેક્ટ્સ આપણાં સમુદાય અને ટ્રાન્ઝિટ પર અવલંબિત લોકો માટે નિર્ણાયક છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણથી સમુદાયોને પૂરું પડતા જીવનની ગુણવત્તામાં સુધારો થાય છે.”

- રોવેના સેન્ટોસ (Rowena Santos), પ્રાદેશિક કાઉન્સિલર, વોર્ડ્સ 1 અને 5; પ્રમુખ, કમ્યુનિટી સર્વિસીસ, સીટી ઓફ બ્રમ્પટન

“આજનું આ રોકાણ, સીધીસીધું આપણાં સમુદાય અને તેના ભાવિ વિકાસને ફળશે, તે ઘણાં બધાં રહેવાસીઓના જીવન પર અસર કરશે. વધારે આરોગ્યપ્રદ અને કાયમી સમુદાયને સહાયરૂપ થવાથી, દરેક વ્યક્તિ કંઈક મેળવ્યું હોવાની અનુભૂતિ કરશે જ્યારે અમે આપણાં સમુદાયોમાં રોકાણ કરીએ છીએ.”

- ચાર્માઇન વિલિયમ્સ (Charmaine Williams), સીટી કાઉન્સિલર, વોર્ડ્સ 7 અને 8; ઉપ-પ્રમુખ, કમ્યુનિટી સર્વિસીસ, સીટી ઓફ બ્રમ્પટન

“બ્રમ્પટનની ટ્રાન્ઝિટ સિસ્ટમ કેનેડામાં સૌથી ઝડપથી વિકસી રહેલી ટ્રાન્ઝિટ સિસ્ટમમાંની એક છે. આપણાં ફેડરલ અને પ્રોવિન્સિયલ ભાગીદારોની સહાયતા વડે, અમે આગામી વર્ષોમાં આપણાં રહેવાસીઓને સુલભ અને કાયમી સ્વરૂપનું પરિવહન પૂરું પાડી શકીએ છીએ. માળખાગત સગવડોમાં ઉન્નતિ અને વિકાસ આપણાં સમુદાયના ભવિષ્ય માટે મહત્વનું રોકાણ બની રહે છે. આપણાં શહેરની જરૂરિયાતોને સંબોધતી આ ભાગીદારીઓ કરવા અમે કટિબદ્ધ છીએ.”

- ડેવિડ બાર્રિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

मिडिया संपर्क :

मोनिका दुग्गल (Monika Duggal)

कोऑर्डिनेटर, मिडिया अन्ड कम्युनिटी एंगेजमेन्ट

व्यूडाल्मक संवाड

सीटी ओफ् ब्रॅम्पटन

905-874-3426 | Monika.Duggal@brampton.ca